

કપાસ સંશોધન ક્ષેત્રે ગુજરાત



ડૉ. બી. જી. સોલંકી
સંશોધન વૈજ્ઞાનિક(કપાસ)


મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર
નવસારી કૃષિ યુનિવર્સિટી
સુરત





ऐतिहासिक कपास संशोधन केन्द्र, सुરतनी जूनी कचेरी

ગુજરાતના કપાસના ઝોન તથા સંશોધન કેન્દ્રો



દક્ષિણ ગુજરાત કપાસ ઝોન

મધ્ય ગુજરાત કપાસ ઝોન

વાગડ કપાસ ઝોન

ભઠિયો કપાસ ઝોન

● મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર

■ વિભાગીય સંશોધન કેન્દ્ર

▲ પેટા સંશોધન કેન્દ્ર

ગુજરાતના કપાસ પકવતા જીવાઓ



ગુજરાતમાં કપાસ સંશોધન માટેનું માળખુ

૧	દક્ષિણ ગુજરાત કપાસ ઝોન : નર્મદા નદીનો દક્ષિણ વિસ્તાર મધ્યમથી ભારે કાળી જમીન અને સરેરાશ વરસાદ ૧૦૦૦ થી ૧૫૦૦ મીમી			
	૧	મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, સુરત	પીપિત વિસ્તાર માટે જાત વિકસાવવાનું તેમજ પાયાનું સંશોધન અને બીજા કેન્દ્રોને માર્ગદર્શન	૧૮૬૬
	૨	પેટા સંશોધન કેન્દ્ર, અછાલીયા	બિનપિયત અને બિન સમથળ જમીન માટે કપાસ સંશોધન	૧૮૬૭
	૩	પેટા સંશોધન કેન્દ્ર, હાંસોટ	જૈવિક પાક સંરક્ષણ માટેનું સંશોધન	૧૮૬૪
૨	મધ્ય ગુજરાત કપાસ ઝોન: ઉત્તર દક્ષિણીય સાબરમતી અને દક્ષિણ નર્મદા વચ્ચેનો વિસ્તાર કાળી થી ગોરાડુ જમીન અને સરેરાશ વરસાદ ૬૦૦ થી ૧૦૦૦ મીમી			
	૧	વિભાગીય સંશોધન કેન્દ્ર, ભરૂચ	બિનપિયત, સુકારા પ્રતિકારક અને દેશી જાતોનું સંશોધન	૧૮૨૬
	૨	વિભાગીય સંશોધન કેન્દ્ર, તલોંદ	પિયત અને લંબતારી જાતોનું સંશોધન	૧૮૫૭
	૩	વિભાગીય સંશોધન કેન્દ્ર, આણંદ	પિયત, ઈજીપ્સીયન કપાસ અને ગુણવત્તા માટેનું સંશોધન	૧૮૭૭

ગુજરાતમાં કપાસ સંશોધન માટેનું માળખુ

૩	વાગડ કપાસ ઝોનઃ ઉત્તર પૂર્વીય સાબરમતી, કચ્છ અને સૌરાષ્ટ્ર (મઠિયા વિસ્તાર રહિત) રેતાળ થી મધ્યમ કાળી અને સરેરાશ વરસાદ તુંબું થી ૭૫૦ મીમી		
૧	વિભાગીય સંશોધન કેન્દ્ર, વીરમગામ	બિનપિયત, બંધ જીડવા અને અર્ધ ખુલ્લા જીડવા માટેની હરબેસીયમ જાતોનું સંશોધન	૧૯૨૨
૨	વિભાગીય સંશોધન કેન્દ્ર, જુનાગઢ	સંક્રણથી લંબતારી જાતોનું સંશોધન	૧૯૬૨
૩	પેટા કપાસ સંશોધન કેન્દ્ર, ઘંધુકા	બિનપિયત ભાલ વિસ્તાર માટે સંશોધન	૧૯૬૨
૪	પેટા કપાસ સંશોધન કેન્દ્ર, રાતીયા અને ખાપટ	બિનપિયત ઘેડ વિસ્તાર માટે સંશોધન	૧૯૬૨
૫	વિભાગીય સંશોધન કેન્દ્ર, ભયાઉ	બિનપિયત કચ્છ વિસ્તાર માટે સંશોધન	૧૯૬૨
૪	મઠિયો કપાસ ઝોનઃ ભાવનગર, અમરેલી અને આજુબાજુના જિલ્લા મધ્યમ કાળી થી હલકી જમીન અને સરેરાશ વરસાદ ૫૦૦ મીમી		
૧	વિભાગીય સંશોધન કેન્દ્ર, અમરેલી	દેશી કપાસની જાતો વિકસાવવાનું સંશોધન	૧૯૭૭



કપાસ સંશોધન કેન્દ્ર, સુરતની હાલની કચેરી



અધ્યતન બાયોટેકનોલોજી લેબોરેટરી , સુરત કેન્દ્ર

કપાસનો વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતા

વર્ષ	ગુજરાત			ભારત		
	વિસ્તાર (લાખ હે.)	ઉત્પાદન (લાખ ગાંસડી)	ઉત્પાદકતા (કિલો રૂ પ્રતિ હે.)	વિસ્તાર (લાખ હે.)	ઉત્પાદન (લાખ ગાંસડી)	ઉત્પાદકતા (કિલો રૂ પ્રતિ હે.)
૨૦૦૧-૦૨	૧૬.૮૭	૩૨.૫૦	૩૨૮	૮૭.૩૦	૧૫૮	૩૦૮
૨૦૦૨-૦૩	૧૬.૩૪	૩૦.૫૦	૩૧૭	૭૬.૬૭	૧૩૬	૩૦૨
૨૦૦૩-૦૪	૧૬.૪૭	૪૦.૦૦	૪૧૬	૭૬.૩૦	૧૭૬	૩૬૬
૨૦૦૪-૦૫	૧૬.૦૬	૭૩.૦૦	૬૪૧	૮૭.૮૬	૨૪૩	૪૭૦
૨૦૦૫-૦૬	૧૬.૦૬	૮૮.૦૦	૭૮૪	૮૬.૭૭	૨૪૧	૪૭૨
૨૦૦૬-૦૭	૨૩.૬૦	૧૦૩.૦૦	૭૩૩	૮૧.૪૪	૨૮૦	૫૨૧
૨૦૦૭-૦૮	૨૪.૨૨	૧૧૦.૦૦	૭૭૨	૮૪.૧૪	૩૦૭	૫૫૪
૨૦૦૮-૦૯	૨૩.૫૪	૮૦.૦૦	૬૪૦	૮૪.૦૬	૨૮૦	૫૨૪
૨૦૦૯-૧૦	૨૬.૫૪	૬૮.૦૦	૬૩૫	૧૦૩.૧૦	૩૦૪	૫૦૩
૨૦૧૦-૧૧	૨૬.૩૩	૧૦૬.૨૦	૬૮૬	૧૧૧.૪૨	૩૩૮	૫૧૭
૨૦૧૧-૧૨	૨૮.૬૨	૧૨૦.૦૦	૬૮૯	૧૨૧.૭૮	૩૪૩	૪૮૩
૨૦૧૨-૧૩	૨૩.૬૩	૮૪.૦૦	૬૯૨	૧૧૬.૧૪	૩૩૪	૪૮૯
અંદર્ભીત						

વિશ્વમાં/ દેશમાં ગુજરાતનું સંશોધન ક્ષેત્રે સૌપ્રથમ પ્રદાન

અનું	કપાસની જાત	પ્રદાન	વર્ષ
૧	દેવીરાજ(૧૭૦ સીઓ-૨)	સૌપ્રથમ લંબતારી અને આંતરજાતીય ઈન્ડો અમેરીકન જાત	૧૯૫૧
૨	સંકર-૪	વિશ્વમાં સૌપ્રથમ વ્યાપારીક ધોરણો બહાર પાઢેલ હરસુટમ હાઈબ્રીડ	૧૯૭૧
૩	ગુજરાત કપાસ-૧૦૧	પછાત વિસ્તારના આદિવાસી ખેડુતો માટે સૌપ્રથમ બહુવર્ષાયુ કલમી કપાસ	૧૯૭૭
૪	ગુજરાત કપાસ દેશી સંકર-૭	દુનિયાની સૌપ્રથમ દેશી કપાસની સંકર જાત	૧૯૮૪
૫	ગુજરાત કપાસ દેશી સંકર-૮	દેશી કપાસની લંબતારી સંકર જાત	૧૯૮૮
૬	ગુજરાત કપાસ એમડીએચ-૧૧	નર વંધ્યત્વની તાંત્રિકતાથી વિકસાવેલ દેશી હાઈબ્રીડ જાત	૨૦૦૨
૭	ગુજરાત કપાસ સંકર-૧૦૨	હરસુટમ અને બારબાડેન્સ કપાસના સંકરણથી લંબતારી સંકર જાત	૨૦૦૨
૮	ગુજરાત કપાસ સંકર-૬ બીજી-૨ અને ગુજરાત કપાસ સંકર-૮ બીજી - ૨	વિશ્વની સૌપ્રથમ જાહેર સાહસની બીટી કપાસની જાતો	૨૦૧૨

ગુજરાત કપાસ સંકર-૬ બીજી-૨ (૭૫ દિવસે)





- જીડવા કોરી ખાનાર ઈયળો સામે સંરક્ષણ પૂરુષ પાડતી,
- ચુસિયાં પ્રકારની જીવાતો માટે ઓછી થી મધ્યમ પ્રતિકારક,
- ખાસ કરીને પિયત વિસ્તાર માટે વહેલી પાકતી
- સંકર-૪ કરતાં વધુ ઉત્પાદન આપતી
- આપતી, તાંતણાની (રેશાની) મજબૂતાઈ માટે અને સંકર-૪ કરતા વણાટકામ (સ્પીનિગ) માટે સારી
- પિયતની સગવડે વહેલી વાવણી (જુન પ્રથમ અઠવાડીએ) થકી વધુ ઉત્પાદન આપતી

ગુજરાત કપાસ સંકર-૬ બીજી-૨ (૭૫ દિવસે)

ગુજરાત કપાસ સંકર-૮ બીજી-૨ (૭૫ દિવસે)





- જીડવા કોરી ખાનાર ઈયળો સામે સંરક્ષણ પૂરુષ પાડતી,
- ચુસિયાં પ્રકારની જીવાતો માટે મધ્યમ પ્રતિકારક,
- સંકર-૬ બીજી-૨ જાતથી બે-ત્રણ અઠવાડીઆ વહેલી પાકતી
- પિયત વિસ્તાર માટે બીજો પાક લેવાની અનુકૂળતા માટે તેમજ
- વરસાદ આધારિત બિન પિયત વિસ્તાર માટે પૂણ અનુકૂળ અને વધુ ઉત્પાદન આપતી જાત

ગુજરાત કપાસ સંકર-૮ બીજી-૨ (૭૫ દિવસે)

બહાર પાડેલ સ્થાયી અને સંકર જાતોનું વિહુંગાવલોકન

અનું.	જાત	બહાર પાડ્યાનું વર્ષ	પાકવાના દિવસો	કપાસનું ઉત્પાદન ક્રિ/હેક્ટર	રૂ ની ટકાવારી	તારની લંબાઈ મીમી	તારની બારીકાઈ	તારની મજબુતાઈ જી/ટેક્શન	તેલના ટકા
-------	-----	---------------------------	------------------	-----------------------------------	------------------	------------------------	------------------	-------------------------------	-----------

ગોસીપીયમ આરબોરીયમ

૧	ગુ. કપાસ-૧૫	૧૯૮૯	૧૨૦-૧૪૦	૧૧૦૮	૩૨.૮	૨૧.૧	૫.૭	૪૭.૨	૧૮.૩૦
૨	ગુ. કપાસ-૧૬	૧૯૯૭	૧૧૦-૧૨૦	૧૧૦૧	૩૪.૪	૨૫.૪	૪.૪	૪૦.૮	૧૮.૩૧

ગોસીપીયમ હરબેસીયમ

૧	દીંગીજય	૧૯૫૬	૨૬૦	૬૬૭	૩૮	૨૩.૧	૪.૪	૮.૫	૧૭.૨૦
૨	ગુ. કપાસ-૧૭	૧૯૯૪	૨૦૦-૨૩૦	૧૩૭૪	૪૦.૪	૨૨.૫	૪.૧	૪૭.૧	૧૭.૫૮
૩	ગુ. કપાસ-૨૩	૨૦૦૦	૧૬૦-૨૧૦	૧૩૦૦	૩૮.૧	૨૨.૪	૪.૨	૨૨.૬	૧૮.૫૨
૪	ગુ. નવસારી કપાસ-૨૫	૨૦૦૯	૧૬૦-૨૧૦	૧૪૦૦	૩૮.૩	૨૩.૧	૫.૧	૧૭.૪	-
૫	વી-૭૮૭	૧૯૬૬	૨૬૦-૩૦૦	૭૮૭	૩૮.૬	૨૨.૬	૩.૬	૭.૭	૧૮.૧૭
૬	ગુ. કપાસ-૧૩	૧૯૮૧	૨૪૫-૨૮૦	૮૮૭	૩૮.૪	૨૩.૨	૪.૩	૪૫.૧	૧૮.૧૩
૭	ગુ. કપાસ-૨૧	૧૯૯૮	૨૧૫-૨૨૫	૧૧૨૬	૪૨.૧	૨૩.૬	૫.૩	૫૨.૮	૧૮.૮૮
૮	આણંદ દેશી કપાસ-૧	૨૦૧૦	૨૨૦	૧૧૭૬	૪૦.૮	૨૨.૨	૫.૬	૧૭.૪	-

દેશી હાઈષ્રીડ (ગોસીપીયમ હરબેસીયમ × ગોસીપીયમ આરબોરીયમ)

૧	ગુ. કપાસ-ડીએચ-૭	૧૯૮૪	૧૮૦-૨૦૦	૧૮૦૮ (૨૬૦૦ *)	૩૭.૫	૨૧.૮	૫.૬	૮.૪	૧૮.૦૧
૨	ગુ. કપાસ-ડીએચ-૮	૧૯૯૬	૧૮૦-૨૦૦	૨૧૦૮	૩૪.૧	૨૮.૪	૪.૭	૪૮.૨	૧૮.૯૨

નર વંધ્યત્વની તાંત્રિકતાથી વિકસાવેલ દેશી હાઈષ્રીડ જાત

૧	ગુ. કપાસ-એમડીએચ-૧૧	૨૦૦૨	૧૨૦-૧૪૦	૧૩૦૭ (૨૭૨૭ *)	૩૬.૫	૨૩.૮	૫.૭	૧૮.૦	૨૦.૫૮
---	--------------------	------	---------	------------------	------	------	-----	------	-------

ગોસીપીયમ હીરસુટમ

૧	દેવીરાજ	૧૮૫૧	૨૬૦	૧૨૪૦	૩૬.૩	૨૭.૪	૩.૭	૭.૨	-
૨	ગુ. કપાસ-૧૦	૧૮૭૪	૧૮૦	૧૩૪૦	૩૪.૭	૨૪.૩	૪.૨	૮.૯	૧૮.૪૦
૩	ગુ. કપાસ-૧૨	૧૮૮૧	૨૧૦-૨૨૦	૬૦૦	૩૬	૨૪.૩	૪.૩	૮.૪	૧૬.૫૭
૪	ગુ. કપાસ-૧૬	૧૮૮૫	૧૩૪-૧૪૦	૧૬૦૬	૩૬.૭	૨૬.૮	૪.૨	૪૭.૯	૨૧.૭૮
૫	ગુ. કપાસ-૧૮	૧૮૮૯	૧૭૪-૧૮૦	૧૫૩૪	૩૪.૦	૨૭.૪	૩.૬	૧૭.૬	૨૧.૨૦
૬	ગુ. કપાસ-૨૦	૨૦૦૭	૧૭૦-૧૬૦	૧૭૬૦	૩૪.૯	૨૫.૪	૫.૭	૨૧.૭	-

ગોસીપીયમ હીરસુટમ × ગોસીપીયમ બારબાડેન્સ હાઈથ્રીડ

	ગુ. કપાસ-હાઈથ્રીડ -૧૦૨	૨૦૦૨	૨૨૦-૨૩૦	૧૮૬૭	૩૩.૪	૩૪	૩.૬	૨૫.૩	૧૭.૦૬
--	------------------------	------	---------	------	------	----	-----	------	-------

ગોસીપીયમ હીરસુટમ × ગોસીપીયમ હીરસુટમ હાઈથ્રીડ

૧	સંકર-૪	૧૮૭૧	૨૧૦-૨૩૦	૨૧૦૩ (૩૪૦૦ *)	૩૩.૪	૨૬.૭	૩.૪	૭.૪-૮.૪	૨૧.૮૨
૨	ગુજરાત સંકર-૬	૧૮૮૦	૧૮૦-૨૧૦	૧૩૦૪ (૩૮૦૦ *)	૩૩.૬	૨૭.૪	૪.૨	૮.૭	૨૧.૭૦
૩	ગુજરાત સંકર-૮	૧૮૮૮	૧૭૦-૧૬૦	૧૮૨૪ (૩૭૭૪ *)	૩૬.૫	૨૫.૮	૪.૪	૪૭.૮	૨૦
૪	ગુજરાત સંકર-૧૦	૧૮૮૫	૧૮૦-૨૧૦	૧૮૩૭ (૩૮૦૪ *)	૩૪.૬	૨૮.૯	૪.૩	૪૩.૭	૧૭.૬૧
૫	ગુજરાત સંકર-૧૨	૨૦૦૪	૧૭૪-૧૬૦	૧૮૨૯	૩૪.૨	૨૬.૬	૪.૨	૨૨.૬	૨૩.૩૮

જાહેર સાહસની બીજી સંકર જાતો

૧	ગુ. સંકર -૬ બીજી-૨	૨૦૧૨	૧૮૦-૨૧૦	૧૩૦૪ (૩૮૦૦ *)	૩૩.૬	૨૭.૪	૪.૨	૮.૭	૨૧.૭૦
૨	ગુ. સંકર-૮ બીજી-૨	૨૦૧૨	૧૭૦-૧૬૦	૧૮૨૪ (૩૭૭૪ *)	૩૬.૫	૨૫.૮	૪.૪	૪૭.૮	૨૦

નવી જાત




માતૃ-પિતૃ	SRT GMS-1 x GSav-1056
બહાર પાડયાનુ વર્ષ	2002
સરેરાશ ઉત્પાદન(કી/હે)	1307
રૂનું ઉત્પાદન(કી/હે)	629
રૂ ની ટકાવારી	36.5
તારની લંબાઈ(મીમી)	23.8
તારની બારીકાઈ (એમવી)	5.7
તારની મજબુતાઈ	19.0
તારની સરખાઈ	51
પરિપક્વતા આંક	0.83
જાતનો સમયગાળો	120-140
ભલામણ કરેલ વિસ્તાર	સમગ્ર ગુજરાત રાજ્ય

ગુ. કપાસ નર-વંધ્યત્વ સંકર -૧૧

(નર-વંધ્યત્વતા આધારીત પ્રથમ દેશી સંકર જાત)


નવી વિકસાવેલ જતો



ગુ. કપાસ સંકર-૧૨

માતૃ- પિતૃ	G.Cot.16 x 76IH 20
બહાર પાડ્યાનુ વર્ષ	2005
સરેરા ઉત્પાદન(કી/હે)	1849
રણું ઉત્પાદન(કી/હે)	1882
પિયતમં ઉત્પાદન(કી/હે)	1809
બિનપિયતમ ઉત્પાદન(કી/હે)	629
રૂ ની ટકાવારી	34.0
તારની લંબાઈ(મીમી)	26.6
તારની બારીકાઈ (એમવી)	4.2
તારની મજબુતાઈ	22.8
તારની સરખાઈ	51
પરિપક્વતા આંક	0.79
જતનો સમયગાળો	175-190
ભલામણ કરેલ વિસ્તાર	All over Gujarat State

નવી જત



ગુ. કપાસ સંકર-૧૦૨

માતૃ- પિતૃ	GSHV-112x GSB-39
બહાર પાડયાનુ વર્ષ	2002
સરેરાશ ઉત્પાદન(કી/હે)	1967 (13.8 % સંકર 8 કરતા વધુ)
રનું ઉત્પાદન(કી/હે)	657
રૂ ની ટકાવારી	33.4
તારની લંબાઈ(મીમી)	34.0
તારની બારીકાઈ (એમવી)	3.6
તારની મજબુતાઈ	25.3
તારની સરખાઈ	48
પરિપક્વતા આંક	0.76
જતનો સમયગાળો	220-230
ભલામણ કરેલ વિસ્તાર	સમગ્ર ગુજરાત રાજ્ય

ગુજરાત કપાસ સંકર-૬ બીજી-૨

માતૃ -પિતૃ Parentage	ગુ.કપાસ-૧૦૦ × ગુ.કપાસ-૧૦ (બીજી) G. Cot. – 100 X G. Cot 10 (Bt)
નિકાર પાડવાનું વર્ષ Year of release	2012
કપાસનું સરેરાશ ઉત્પાદન(ક્ર./એ.) Average seed cotton production (kg/ha)	1981
રૂંનું સરેરાશ ઉત્પાદન (ક્ર. /એ.) Average lint yield (kg/ha)	619
રૂંની ટકાવાઈ Ginning percentage	31.8
તારની લંબાઈ (૨.૫ %) (મીલી) Span length (2.5%) (mm)	29.8
તારની બાદીકાઈ (એમવી.) Fineness (mv)	4.2
તારની મજબૂતાઈ (ગ્રામ / ટેક્સ) Tenacity (g/tex)	23.4
તારની સરખાઈ Uniformity	48
તારનો પરિપક્વતા કોફિન Maturity coefficient	0.84
પાકવાના દિવસો Days of maturity	190-210
લિશોખ ગુણવત્તમો Special characteristics	ઉચ્ચ ગુણવત્તા વિરાસતી સ્પેચ માટે ખૂબજ અનુકૂળ, જીડવા નાનારી રીતના સામે પ્રતિકારક. A quality hybrid suitable for irrigated tract, resistant to bollworms and moderately tolerant to sucking pest.
ભાવામણ કરેલ રિસ્ટાર Area of adoption	ગુજરાત, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ Gujarat, Maharashtra and Madhya Pradesh

ગુજરાત કપાસ સંકર-૮ બીજી-૨

માત્ર - પિતૃ Parentage	ગુ.કપાસ-૧૦ (બીટી) × સુરત ડવાર્ફ G. Cot. – 10 (Bt) X Surat Dwarf
બનાર પાડયાનું વર્ષ Year of release	2012
કપાસનું સરેરાશ ઉત્પાદન (ક્ર. /ઝ.) Average seed cotton production (kg/ha)	2231
રણ્ણ સરેરાશ ઉત્પાદન (ક્ર. ક્ર.) Average lint yield (kg/ha)	789
રણ્ણ ટકાવારી Ginning percentage	35.4
તારની લંબાઈ (૨.૫%) (મીમી) Span length (2.5%) (mm)	28.1
તારની બારીકાઈ (એમ્વી.) Fineness (mv)	4.2
તારની મજલુતાઈ (ગ્રામ / ટેક્સ) Tenacity (g/tex)	21.6
તારની સરખાઈ Uniformity	47
તારનો પરિપક્વતા કોષ્ટક Maturity coefficient	0.83
પાકવાના દિવસો Days of maturity	170-190
વિશેષ ગુણવત્ત્વો Special characteristics	વહેલી પાકતી, પિયત અને બિન પિયત માટે અનુકૂળ જીડિવા નાનારી ઈયણ સામે પ્રતિકારક ચુસ્તિયા પ્રકારની જીવાત સામે મહદ અંશે પ્રતિકારક. An early maturing hybrid suited to rainfed and irrigated situation resistant to boll worm and moderately tolerant to sucking pest.
ભલામણ કરેલ વિસ્તાર Area of adoption	ગુજરાત, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ Gujarat, Maharashtra and Madhya Pradesh

ઉનાળામાં બે થી ત્રણ વર્ષો એક વાર જમીનની ઉડી ખેડ



પિયત પાણીનો ઉત્ત% જેટલો બચાવ



ટપક પદ્ધતિ અપનાવવા જોડિયા હાર પદ્ધતિથી વાવેતર


૪૦ ટકા પિયત પાણી અને
૨૫ ટકા નાઈટ્રોજનનો બચાવ



Drip irrigation in cotton (Paired row planting)

જોડિયા હાર વચ્ચે ૧૮૦ સેમી ,બે લાઈન વચ્ચે ૬૦ સેમી અને બે છોડ વચ્ચે ૪૫ સેમી

આંતરપાક પદ્ધતિ



આંતરપાક પદ્ધતિ


કપાસ સાથે ચોળા, સોયાબીન કે અડદ

આંતરપાક પદ્ધતિ

કપાસ સાથે મગફળી

જુદી જુદી જીવાતોના નિયંત્રણ માટે ભલામણ કરેલ જંતુનાશક દવાઓનું પ્રમાણ

ક્રમ	જંતુનાશક દવાનું નામ	૧૦ લી. પાડીમા દવાનું પ્રમાણ (મીલી)
૧	મોલોમથી, તડતડિયા, થીખસ માટે	
	ઇભીડાફ્લોપ્રીડ ૨૦૦ એસએલ	૪
	થાયામીથોક્ઝામ ૨૫ ડબલ્યુજી	૪
	એસીટામીપ્રીડ ૨૦ એસપી	૨
	મીથાઈલ-ઓ-ડીમેટોન ૨૫ ઈસી	૧૦
	મોનોકોટોફોસ ૩૫ એસ.એલ.	૧૦
	ડાયમીથોએટ ૩૦ ઈસી	૧૦
૨	મીલીબગ માટે	
	ટ્રાયઝોફોસ ૪૦ ઈસી	૨૦
	કવીનાલફોસ ૨૫ ઈસી	૨૦
	કલોરપાયરીફોસ ૨૦ ઈસી	૨૫
	મોનોકોટોફોસ ૩૫ એસ.એલ.	૨૫
૩	સફેદ માણી માટે	
	મીથાઈલ-ઓ-ડીમેટોન ૨૫ ઈસી	૧૦
	ટ્રાયઝોફોસ ૪૦ ઈસી	૧૫
	મોનોકોટોફોસ ૩૫ એસ.એલ.	૨૫
	એસીફેટ ૭૫ એસપી	૧૫
	લીમડાની બનાવટની દવા ૩૦૦૦ પીપીએમ	૪૦
	લીમડાની બનાવટની દવા ૧૦૦૦૦ પીપીએમ	૨૦
	લીમડાનું તેલ	૪૦
૪	લાલ કથીરી	
	કેલ્વેન ૧૮.૫ ઈસી	૨૫
	ડાયકોફોલ ૧૮.૫ ઈસી	૧૦
	ઇથીઓન ૫૦ ઈસી	૧૦
	સલ્ફર ૫૦ ટ્રકા વે. પા.	૧૦



કૃપાસમાં આવતી પાનની લાલાશ

કુપાસના પાકમાં લાલ પાન થતા અટકાવવાના ઉપાયો

- છોડમાં નાઈટ્રોજન તત્વની ઉણપ જોવા મળે તો યુરીયા ખાતરનો ૨% પ્રમાણે છોડ પર એક થી બે છંટકાવ કરવા.
- કુલ-ભમરી બેસવાની અવસ્થાએ પોટેશિયમ નાઈટ્રોટનું ૩% દ્રાવણ દસ દિવસના ગાળે ઉ છંટકાવ કરવા.
- મેગ્નેશિયમ અને બીજા પોષક તત્વો પાણી ભરાઈ રહેવાથી છોડને અલાભ્ય બને છે. જેથી વધારાના પાણીનો નિકાલ કરવાથી જમીનમાં રહેલા પોષક તત્વો પાકને મળી શકે છે.
- કુલ-ભમરી બેસવાની શરૂઆત અને જીડવાના વિકાસની અવસ્થાએ મેગ્નેશિયમ સંફેટ ૦.૫–૧.૦% અને ઝીક સંફેટ ૦.૫% ના દ્રાવણનો વારાફરતી છોડ પર છંટકાવ કરવો.
- કુપાસમાં આવતી ચુસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે સમયસર પાક સંરક્ષણના પગલાં લેવા.

કપાસમાં સુકારો અટકાવવાના ઉપાયો

- સેન્ટ્રીય ખાતરનો વપરાશ વધારવો.
- અતિશય હલકી જમીનમાં કપાસનું વાવેતર ટાળવું
- ખાસ કરીને હલકી જમીન અને છોડ પર વધુ સંખ્યામાં જીડવા હોય ત્યારે ટૂંકા ગાળે પિયત આપવું.
- પિયત બાદ સુકારો જણાય ત્યારે વરાપે આંતરખેડ કરવી.
- ૩% પોટેશિયમ નાઈટ્રેટનો છંટકાવ કરવો અથવા યુરીયાનું દ્રાવણ મૂળ વિસ્તારમાં આપવું.

આભાર

વધુ માહિતી માટે સંપર્ક કરો

સંશોધન વૈજ્ઞાનિક(કપાસ)

મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર
નવસારી કૃષિ યુનિવર્સિટી

અઠવાઝાર્મ, સુરત-૩૬૫૦૦૫

ફોન: ૦૨૬૧-૨૬૬૮૦૪૫